OMKAR OVERSEAS LIMITED

Registered Office- 212, New Cloth Market, O/S. Raipur Gate, Raipur, Ahmedabad - 380 002
Phone No.: 91-79-22132078

E-mail: omkaroverseas212@gmail.com

Website: www.omkaroverseasltd.com

CIN: L51909GJ1994PLC023680

OOL /SE/2022-23/P27

September 16, 2022

To,
The Manager, Listing
BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Mumbai- 400 001

Dear Sir,

Sub: Publication of Advertisement for the Annual General Meeting Notice, Book Closure and E-voting

Ref.: Company Code: BSE: 531496

With regard to above and in compliance with the Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copies of Financial Express (English) and Jai Hind (Gujarati) edition dated 09th September, 2022 wherein Notice for the 26th Annual General Meeting and the Notice pursuant to provisions of Section 91 and Section 108 of the Companies Act, 2013 for Book Closure and E-voting for the purpose of Annual General Meeting of the Company to be held on 30th September, 2022 was published.

You are requested to kindly find the above in order and arrange for updation of records accordingly.

Thanking You,

Faithfully Yours,

FOR OMKAR OVERSEAS LIMITED

RAMESH DEORA DIRECTOR & CEO

DIN: 01135440

Encl: As Stated

WWW.FINANCIALEXPRESS.COM

IFSC Code:



Government of India, Ministry of Finance

DEBTS RECOVERY TRIBUNAL-II. 3" Floor, Bhikhubhai Chambers, Near Kochrab Ashram, Paldi, Ahmedabad, Gujarat

FORM NO.22 (Earlier 62) [Regulation 36 & 37 of DRT Regulations, 2015] [See Rule 52 (1) (2) of the Second Schedule to the income-tax Act, 1961] Read with The Recovery of Debts Due to Bank and Financial Institutions Act, 1993

THROUGH	E-AUCTI REGD. AD / DASTI / A	ON/SALE NOTICE		
RP/RC No.	14/2020	OA No.	1124/2018	
Certificate Holder Bank		BANK OF INDIA		
		Vs.		
Certificate Debtors		M/s. Om Plastic Industries & Ors.		
o. C.D.No. 1 : M/s	Om Plastic Industries	. (Sole Prop. Mr. Dines)	nbhai Govindbhai Patel). Office /	

Factory: Gala No.106, Modern Industrial Estate, Zari Causeway, Kachigam, Nani Daman, U.T. o Daman & Diu-396210 C.D.No. 2: Mr. Dineshbhai Govindbhai Patel (Proprietor), 402, Sagar Apartment, Khari Ward

Daman-396210 U.T. of Daman & Diu-396210 The aforesaid CDs No.1 - 2 have failed to pay the outstanding dues of Rs.36,52,574.00 (Rupees Thirty Six Lakh Fifty Two Thousand Five Hundred Seventy Four Only) as on 20/06/2018

including interest in terms of judgment and decree dated 31/07/2020 passed in O.A. No.1124/2018 as per my order dated 31/08/2022, the under mentioned property (s) will be sold by public eauction in the aformentioned matter. The auction sale will be held through 'Online E-Auction' https://drt.auctiontiger.net Decayon Drice | FMD 100/ --

No.	Description of the Property	(Rounded off)	(Rounded off) Rs.1.15 Lakh	
100	Flat No.303, 3rd Floor, Shree Omkar Residency, B-3 Building, Old Manor-Palghar Road, Manor, Tal. Palghar & Dist. Palghar.	Rs.11.50 Lakh		
	House No.15-9/A/4th Floor, Sagar Apartment, Near Zill Hill Hotel, S.No.604(48), Khaiwad, Nani Daman, Daman.	Rs.31.00 Lakh	Rs.3.10 Lakh	

Note* In respect of any claims to be received, if any, priority of payment will be decided in terms of Section 31-B of the RDB Act, 1993 (as amended in the year 2016) EMD shall be deposited by

Beneficiary Bank Name :	Bank of India
Beneficiary Bank Address :	Vapi Main Branch : Bank of India, Zanda Chowk, P.B. No.39, Vapi, Vapi-396191
Beneficiary Account No. :	290490200000033

BKID0002904

1. The bid increase amount will be Rs.10,000/- for lot No.1 & 2 each. 2. Prospective bidders may avail online training form service provider M/s. E-Procurement Technologies Ltd. (Tel. Helpline No.9265562821 - 079 61200594 / 598 / 568 / 587 / 538 and Mr. Ram Sharma (Mobile No.09978591888), Helpline E-mail ID: support@auctiontiger.net and for any property related queries may contact Shri Vined Kumar Garg, Chief Manager (Mobile No. 9727386595). 3. Prospective bidders are advised to visit website: Website: https://www.drt.auctiontiger.net for detailed terms & conditions and procedure of sale before submitting their bids. 4. The prospective bidders are advised to adhere payment schedule of 25% (minus EMD) immediately after fall of hammer / Close of auction and 75% within 15 days from the date of auction and if 15th day is Sunday or other Holiday, then on immediate next first bank working day. No request for extension will be entertained. 5. The properties are being put to sale on 'AS IS WHERE IS', 'AS IS WHAT IS' and 'AS IS WHATEVER' basis and prospective buyers are advised to carry out due diligence properly. 6.

1	Inspection of Property	26/09/2022 Between 11.00 am to 02.00 pm	
2	Last date of receiving bids along with earnest money and uploading documents including proof of payment made.	27/10/2022 upto 5.00 pm	
3	e-auction	28/10/2022 Between 12.00 pm to 1.3 pm (with auto extension clause of 03 minutes, till E-Auction ends)	
	ı	Prakash Meena RECOVERY OFFICER - II, Debts Recovery Tribunal -II, AHMEDABA	

PARMAX PHARMA LIMITED PHARMALTD. (CIN: L24231GJ1994PLC023504)

Registered Office: Plot No. 20, Survey No. 52, Rajkot-Gondal National Highway No.27, Hadamtala, Rajkot -360311 GJ, IN.

NOTICE FOR 28[™] ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING

NOTICE is hereby given that the 28" Annual General Meeting (AGM) of the Members of Parmax Pharma Limited ('the Company') will be held on Friday, 30" September, 2022 at 2.00 p.m. at registered office of the company at Plot No. 20, Survey No. 52, Rajkot-Gondal National Highway No. 27, Hadamtala, Rajkot-360311, Gujarat, India to transact the business as set out in the Notice approved in Board Meeting dated 12" August, 2022 convening the AGM.

The Notice of the 28" AGM and Annual Report for the financial year 2021-22 have been sent by email to all those members of the Company whose email IDs are registered with the Company/Depository Participants. Members desiring to receive the said documents in physical form will continue to get the same in physical form free of cost upon request.

NOTICE is hereby further given that pursuant to Section 91 of the Companies Act, 2013 read with rules made there under and as per Regulation 42 of SEBI (LODR) Regulations, 2015, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from 24" September, 2022 to 30" September, 2022 (both days inclusive), for the purpose of the above referred 28th Annual General Meeting of the Company.

Any Person, who acquires shares of the Company and becomes member of the Company after dispatch of the Notice of AGM on 8" September, 2022 and holding shares as on the cut-off date i.e. on 23" September, 2022 may obtain the login ID and password by sending a request at helpdesk.evoting@cdslindia.com.

As per Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015, the Company is providing its members the facilities to cast their vote by 'Remote e-voting' (i.e. e-voting from a place other than venue of AGM) on all the resolutions set forth in the said Notice. The details as required pursuant to the provisions of the Companies Act, 2013 and Rules made thereunder are given here under:

Date of completion of dispatch of Notice AGM: 8" September.

Date & Time of commencement of Remote e-voting: 09.00 a.m. on 27" September, 2022

 Date & Time of end of Remote e-voting: 5.00 p.m. on 29° September, 2022

 Cut-off date for determining rights of entitlement of Remote evoting: 23" September, 2022

Those persons who have acquired shares and have become members of the Company after dispatch of notice of AGM by the Company and whose names appear in the Register of Members of the Company/ in the statement of beneficial owners maintained by depositories as on cut-off date can exercise their voting rights through Remote e-voting by following the

Remote e-voting shall not be allowed beyond: After 5.00 p.m. on 29" September, 2022

procedure as mentioned in the said Notice of AGM.

Manner of casting vote on resolutions at the venue of AGM. The facility of voting through 'Ballot Paper shall be made available at the venue of AGM. E-voting facility will not be made available at the venue of AGM. Members who have already cast their vote by remote e-voting prior to the AGM can attend the AGM but shall not be entitled to cast their vote again at AGM.

 Notice of 28" Annual Report is available on Company's website & on CDSL website: www.parmaxpharma.com & www.evotingindia.com

9) In case of any queries or issues regarding e-Voting, shareholders may refer the Frequently Asked Questions ("FAQs") and e-Voting manual available at www.evotingindia.com under help section or write an email to helpdesk.evoting@cdslindia.com

Place: - Hadmtala Date : - 8" September 2022 By Order of the Board For Parmax Pharma Limited

Din No.: 05153830

Mr. Umang Gosalia **Manging Director**

.》意气. MARL GREEN

PEARL GREEN CLUBS AND RESORTS LIMITED CIN: U55101GJ2018PLC100469 Registered Office address: UP GF-01, Krushna Complex, Near Choice, Navrangpura Ahmedabad GJ 380009 IN

Website: www. Pearlgreenclubsresort.com E-mail ID: pearlgreencrl@gmail.com

NOTICE OF 04th ANNUAL GENERAL MEETING REMOTE E-VOTING INFORMATION AND BOOK CLOSURE

Notice is hereby given that the Annual General Meeting (AGM) of the members of Pearl Green Clubs And Resorts Limited (Company) will be held on Friday, 30th day of September, 2022 at 11:30 A.M. IST through Video-Conferencing/Other Audio-visual means(VC/OAVM) to transact the businesses as set out in the Notice of AGM in compliance with the applicable provisions of the Companies Act, 2013 (Act) and Rules framed thereunder read with General Circular issued from time to time, respectively circulars issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars").

Electronic copies of the Notice of the AGM and the Annual Report for the financia year ended March 31, 2022 of the Company shall be sent to all the members, whose email ids are registered with the Company/RTA/Depository participant(s), as on the cut-off date i.e. 02nd September, 2022. Please note that the requirement of sending physical copy of the Notice of the AGM and Annual Report to the Members have been dispensed with vide MCA Circulars. The Notice and the Annual Report will also be available and can be downloaded from the website of the Company www.pearlgreenclubsresort.com.

The facility of casting the votes by the members ("e-voting") will be provided by Central Depository Services(India) Limited('CDSL') and the detailed procedure for the same is provided in the Notice of the AGM. The remote e-voting period commences on 27th September, 2022 (09:00 A.M.) and end on 29th September, 2022 (05:00 P.M.) During this period, members of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date of 23rd September, 2022, may cast their vote by remote e-voting or by e-voting at the time of AGM. Members participating through in person shall be counted for reckoning the quorum under Section 103 of the Act.

Members, who are holding shares in physical/electronic form and their e-mail addresses are not registered with the Company/their respective Depository Participants, are requested to register their e-mail addresses at the earliest by sending scanned copy of a duly signed letter by the Member(s) mentioning their name, complete address, folio number, number of shares held with the Company along with self-attested scanned copy of the PAN Card and self-attested scanned copy of any one of the following documents viz., Aadhar Card, Driving License, Election Card, Passport, utility bill or any other Govt, document in support of the address proof of the Member as registered with the Company for receiving the Annual Report 2021-22 along with AGM Notice by email to pearlgreencr@gmail. com . Members holding shares in demat form can update their email address with their Depository Participants. The notice of the AGM contains the instructions regarding the manner in which the shareholders can cast their vote through remote

e-voting or by e-voting at the time of AGM. The Register of Members and Share Transfer books of the Company will remain closed from Saturday, 24th September, 2022 to Friday, 30th September, 2022 (both

The Notice of AGM and Annual Report for the financial year 2021-22 will be sent to

members in accordance with the applicable provisions in due course. For Pearl Green Clubs And Resorts Limited

Hemantsingh Naharsingh Jhala

Place: Ahmedabad (Managing Director) Date: 08-09-2022 DIN: 07776928



OMKAR OVERSEAS LTD. Registered Office: 212, New Cloth Market, O/s. Raipur Gate, Raipur, Ahmedabad - 380 002 Phone No. : 91-79-22132078 E-mail: omkaroverseas212@gmail.com Website: www.omkaroverseasltd.com

CIN: L51909GJ1994PLC023680 **NOTICE OF 26TH ANNUAL GENERAL MEETING** E-VOTING & BOOK CLOSURE INFORMATION

Notice is hereby given that

f) The 26th Annual General Meeting (AGM) of the Company will be held on Friday, 30th September, 2022 at 12:00 P.M. at the registered office of the Company situated at 212, New Cloth Market, O/s. Raipur Gate, Ahmedabad 380002 to transact the businesses as set out in the Notice of the Meeting dated 12th August, 2022.

Electronic copies of the Notice of the AGM and Annual Report for the financial year 2021-22 have been sent to all the Members holding shares on 02nd September, 2022, whose email IDs are registered with the Company / Depository Participant(s). These documents are also available on the website of the Company at www.omkaroverseasitd.com and also on the website of

Central Depository Services (India) Limited (CDSL) at www.evotingindia.com and website of Bombay Stock Exchange (BSE) at www.bseindia.com. The Notice of AGM and Annual Report have been sent to all other Members at their registered address in the permitted mode. The dispatch of Notice of AGM has been completed on 08th September, 2022. Members holding shares either in physical form or dematerialized form as on

the cut-off date (23rd September, 2022) may cast their vote electronically on the business as set forth in the Notice of the AGM through Electronic Voting System of the Central Depository Services (India) Limited (CDSL) from a place other than venue of the AGM (remote e-voting). All the Members are informed that: I. The business as set forth in the Notice of the AGM may be transacted through voting by electronic means;

II. The remote e-voting shall commence on Tuesday, 27th September, 2022 (9:00 a.m.); III. The remote e-voting shall end on Thursday, 29th September, 2022 (5:00 p.m.) IV. The cut-off date for determining the eligibility to vote by electronic means or at the AGM is (23rd September, 2022); V. E-voting by electronic mode shall not be allowed beyond 5:00 p.m. IST on

29th September, 2022; VI. Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after dispatch of the Notice of the AGM and holding shares as on the cut-off date i.e. (02nd September, 2022), may obtain the login ID and password by sending a request at helpdesk.evoting@cdslindia.com//

ahmedabad@linkintime.co.in. VII. Members may note that: a. The remote e-voting module shall be disabled by Central Depository Services (India) Limited (CDSL) beyond 5:00 p.m. IST on 29th September, 2022 and once

the vote on a resolution is casted by the Member, the Member shall not be allowed to change it subsequently: b. The facility for voting through ballot/poll shall be made available at the AGM; c. The Members who have casted their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again; and d. Only persons whose name is recorded in the Register of Members or in the

Register of Beneficial Owners maintained by the depositories as on the cut-off

date only shall be entitled to avail facility of remote e-voting or voting at the

VIII. The Notice of AGM is available on the Company's website www.omkaroverseasltd.com and also on the Central Depository Services (India) Limited (CDSL) website www.evotingindia.com

IX. For e-voting instructions, the Members may go through the instructions in the Notice of AGM and in case of queries/grievances relating to e-voting, members may refer to the frequently asked questions (FAQs) and e-voting user manual available at www.evotingindia.com under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or may at 1800 22 55 33 or contact to Ms. Jinal Shah, Company Secretary & Compliance Officer, at 212, New Cloth Market, O/s. Raipur Gate, Ahmedabad - 380002, email id:

omkaroverseas212@gmail.com, Phone No.91-79-22132078. The Notice is further given that pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013 read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014, the Register of Members of the Company will remain closed from 24th September, 2022 to 30th September, 2022 (both days inclusive).

Place: Ahmedabad Date: 08/09/2022

AGM through ballot/poll;

For, Omkar Overseas Limited Ramesh Deora Chairman & Director - DIN: 01135440

KENVI JEWELS LIMITED CIN:-L52390GJ2013PLC075720

Registered Office: 14, NavDurga Complex, Opp. NavDurga Society, Ambicanagar, Odhav, Ahmedabad - 382415, Gujarat Ph.: 079-22973199. E-Mail: compliance.kjl@gmail.com, Website: www.kenvijewels.com

NOTICE OF 9" ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 9^{\shortparallel} Annual General Meeting (AGM) of the Members of KENVI JEWELS LIMITED is scheduled to be held on Thursday, 29th September 2022 at 01:30 p.m. at the registered office of the company situated at 14, NavDurga Complex, Opp. NavDurga Society, Ambicanagar, Odhav, Ahmedabad - 382415, Guiarat, to transact the business as set out in the Notice of AGM. The company has sent Notice of AGM along with Annual Report for Financial Year 2021-22 on 07" September, 2022 only through electronic mode to the Members whose e-mail id is registered with the Company/Depositories in accordance with the circular issued by Ministry of Corporate Affairs dated May 05, 2020 read with its Circular dated April 08, 2020 April 13, 2020 & January 13, 2021 and SEBI Circular dated May 12, 2020 read with circular January 15, 2021, December 08, 2021 and May 05, 2022.

As Per Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and the Secretarial Standards on General Meeting ("SS-2") issued by the Institute of Company Secretary of India, the Company is providing facility to all its Members to cast their vote on all resolutions to be set forth in the Notice of the AGM by electronic means (e-voting) by using electronic voting system provided by the NSDL. The voting rights of the members shall be in the proportion to the equity share held by them in the paid up equity share of the Company as on Thursday, September 22, 2022 (the "cut-off date"), The details are required pursuant to the provision of the Companies Act, 2013 and rules made thereunder are given below:

 The Book closure period shall commence on 23rd September, 2022 and end on 29th September, 2022 (both days inclusive);

2. The remote e-voting period will commence at 09:00 a.m. on Monday, September 26, 2022 and will end at 05:00 p.m. on Wednesday, September 28, 2022.

3. Cut-off date for determining rights of entitlement of e-voting is Thursday, September 22, 2022;

4. The members will not be allowed to vote through remote e-voting beyond the period as specified above;

5. Shareholder acquiring the share of the company and becomes the members of the company after sending of the Notice and holding Shares as of the cut-off date may follow steps mention in the Notice of AGM to exercise their voting rights;

The Members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend/participate in the AGM but shall not be entitled to cast their vote

The Board has appointed M/s. Shikha Patel & Associates, Practising Company Secretary to act as the Scrutinizer to scrutinize the e-voting procedure, who shall submit the results of voting to the Chairman.

8. In case of any queries/grievances pertaining to remote e-voting you may refer to the Frequently Asked Questions ('FAQs') for Shareholders and e-voting user manual for Shareholders available at www.evoting.nsdl.com under help section or contact at 022-23058542/43.

Date: 07/09/2022

Place: Ahmedabad

Cholamandalam

CORRIGENDUM

Sale Notice Which was Published

in Financial Express, Ahmedabad

Edition, Dated 07-09-222 In that

Notice Borrower 5) Kiran Chohla

6) Amratbhai Sartanbhai Desai 7

Chandan Shyamkuamar Bhavsar

will be read for 15 days instead of

30 days and will remain as they

Authorized Officer

Finance Company Limited

M/s.Cholamandalam Investment and

For, KENVI JEWELS LIMITED Chirag Champaklal Valani Managing Director (DIN: 06605257)

EUTO

EURO INDIA FRESH FOODS LIMITED

(Formerly known as Euro India Fresh Foods Private Limited) Reg. office: A-22/1, Ichhapore GIDC, Hazira-Magdata Road, Surat-394510, Gujarat, India. CIN: L15400GJ2009PLC057789. Email ID: investor@euroindiafoods.com Website: www.euroindiafoods.com Phone: 8261-2913021/3041.

AGM NOTICE

The notice is hereby given that the 13th Annual General Meeting of the Members of EURO INDIA FRESH FOODS LIMITED will be held on Friday, September 30, 2022at 11:00 A.M. at the registered office of the company at Plot No. A-22/1. G.I.D.C.Ichhapore, Surat- 394510, Gujarat, India, To Transact The Ordinary and special Business As Set Out In the Notice of AGM.

BOOK CLOSURE NOTICE

All the Shareholders of the company are informed that the register of members and Share Transfer Books of the company shall remain closed from Saturday, the 24th day of September, 2022 to Friday, the 30th day of September, 2022 (both day inclusive) for the purpose of AGM. The Cutoff date for providing e-voting is Friday the 23rdday of September, 2022.

All the members are hereby informed that:

1. In accordance with the General Circular No. 20/2020 dated May 5, 2020 read with General Circular No. 14/2020 dated April 8, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020 and General Circular No. 02/2021 dated January 13, 2021, issued by the Ministry of Corporate Affairs and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/ P/2021/11 dated January 15, 2021 issued by the Securities Exchange Board of India (SEBI), the Notice of AGM and Integrated Annual Report including the Audited Financial Statements for the financial year 2021-22 have been sent in electronic mode to Members whose e-mail IDs are registered with the Company or the Depository Participant(s). The electronic dispatch of Annual Report to Members has been completed on September07 2022. The copy of the Integrated Annual Report is also available on the Company's website www.euroindiafoods.com.

Pursuant to Section 108 of the Companies Act, 2013, Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015, the Company is providing electronic voting facilities from a place other than the venue of AGM ('remote e-voting') provided by Kfin Technologies Limited, on the resolution set forth in the AGM Notice. The details of remote e-voting are given below:

The remote E-voting period shall commence on Tuesday, September 27, 2022 at 10.00 A.M. and shall end on Thursday, September 29, 2022 at 5.00 P.M. The remote E-voting module shall be disabled for voting thereafter.

The voting right of the Members shall be in proportion to their shares of the Paidup Equity Shares Capital of the Company as on the cutoff date being Friday September 23, 2022.

If any person becomes the Member of the Company after dispatch of AGM Notice but on or before the cutoff date i.e. September 23, 2022; may write for to requesting the User ID and Password on the Email ID: evoting@kfintech.com or to contact KFintech at toll free number 1-800-309-4001.

Once the vote on a resolution is cast by Member, the Member shall not be allowed to change it subsequently,

The Members who cast their vote electronically shall attain the AGM but shall not be entitled to cast their vote again.

e-voting manual available on Kfin Technologies Private Limitedwebsite.

Note: The meeting shall be conducted keeping in view the Government norms such as social distancing, sanitizing the meeting room, temperature checking, etc. In case of any queries or issue on remote e-voting, you may refer the FAQ's and

For, EURO INDIA FRESH FOODS LIMITED

Place: Surat Date: September 08, 2022

Javnika Gandharva Company Secretary & Compliance Officer

Sale of Immovable property mortgaged to IIFL Home Finance Limited (Formerly known as India Infoline Housing Finance Ltd.) (IIFL-Corporate Office at Plot No.98, Udyog Vihar, Phase-IV, Gurgaon-122015. (Haryana) and Branch Office at:- Office No.701, 7th Floor, 21s Centuary Business Center, Near Udhna Darwaja, Ring Road, Surat - 395002 under the Securitisation and Reconstruction of Financia Assets and Enforcement of Security Interest Act. 2002(hereinafter "Act"). Whereas the Auhorized Officer ("AO") of IIFL-HFL had taken the possession of the following property/ies pursuant to the notice issued U/S 13(2) of the Act in the following loan accounts/prospect nos. with a right to sell the same on "AS IS WHERE IS BASIS & AS IS WHAT IS BASIS" for realization of IIFL-HFL's dues, The Sale will be done by the undersigned through e-auction platform provided at the website: www.bankeauctions.com. Borrower(s) / Demand Notice Description of the Date of

Public Notice For E-Auction Cum Sale (Appendix - IV A) (Rule 8(6))

Co-Borrower(s) / Guarantor(s)	Date and Amount	Immovable property/ Secured Asset	Possession	Price	of property
1.Mr. Manoj Chhotubhai Sonar 2. Mrs.Nalini Manoj Sonar (Prospect No 921075 &	18-Feb-2022 Rs.14,18,542/- (Rupees Fourteen Lakh Eighteen Thousand Five Hundred Forty Two Only) Bid Increase Amount	All that part and parcel of the property bearing Plot No. 124, admeasuring 53.36 Sq. Yards, Sai Darshan Residency, R. S. No. 93/1, Block No. 121, Village: Bagumara, Tal. Palsana,	As On Date 02 - Sep - 2022 Rs. 14,25,289/- (Rupees Fourteen Lakh Twenty Five	Rs. 7,55,200/- (Rupees Seven Lakh Fifty Five Thousand Two- Hundred Only) Earnest Money Deposit (EMD) Rs.75,520/-	19-Sep-2022 1100 hrs -1400 hrs. EMD Last Date 21-Sep-2022 till 5 pm. Date/ Time of
794324)	Rs.20,000/- (Rupees Twenty Thousand Only)	Dist.: Surat. 394305, Gujarat,India.	Thousand Two Hundred Eight Nine Only)	(Rupees Seventy Five Thousand Five Hundred Twenty Only)	E Auction 23-Sep-2022 1100 hrs-1300 hrs.
Mode of Payment:- All payment shall be made by demand draft in favour of "IIFL Home Finance Limited" payable at Gurugram or through					

RTGS/NEFT The accounts details are as follows: a) Name of the account:- IIFL Home Finance Ltd., b) Name of the Bank:- Standard Charted Bank Ltd., c) Account No:-53105066294, d) IFSC Code:-SCBL0036025 or through Payment Link: https://quickpay.iiflfinance.com TERMS AND CONDITIONS:-1. For participating in e-auction, Intending bidders required to register their details with the Service Provider https://www.bankeauctions.com

well in advance and has to create the login account, login ID and password. Intending bidders have to submit / send their "Tender FORM along with the payment details towards EMD, copy of the KYC and PAN card at the above mentioned Branch Office. 2. The bidders shall improve their offer in multiple of amount mentioned under the column "Bid Increase Amount". In case bid is placed in the last 5 minutes of the closing time of the auction, the closing time will automatically get extended for 5 minutes

3. The successful bidder should deposit 25% of the bid amount (after adjusting EMD) within 24 hours of the acceptance of bid price by the AO and the balance 75' of the bid amount within 15 days from the date of confirmation of sale by the secured creditor. All deposit and payment shall be in the prescribed mode of payme 4. The purchaser has to bear the cess, applicable stamp duty, fees, and any other statutory dues or other dues like municipal tax, electricity charges, land and all other incidental costs, charges including all taxes and rates outgoings relating to the property 5. Bidders are advised to go through the website https://bankeauctions.com and https://www.iifl.com/home-loans/properties-for-auction for

detailed terms and conditions of auction sale & auction application form before submitting their Bids for taking part in the e-auction sale proceedings 6. For details, help procedure and online training on e-auction prospective bidders may contact the service provider E mail ID:- support@bankeauctions.coi Support Helpline Numbers: @7291981124/25/26.and any property related query Mr. Jitendra Gupta @ 9999682823, Email :-jitendra.gupta1@iifl.com, Notice is hereby given to above said borrowers to collect the household articles, which were lying in the secured asset at the time of taking physical possession within 7 days, otherwise IIFL-HFL shall not be responsible for any loss of property under the circumstances. 8. Further the notice is hereby given to the Borrower/s, that in case they fail to collect the above said articles same shall be sold in accordance with Law

9. In case of default in payment at any stage by the successful bidder / auction purchaser within the above stipulated time, the sale will be cancelled and the amount already paid will be forfeited (including EMD) and the property will be again put to sale. 10. AO reserves the rights to postpone/cancel or vary the terms and condition of tender/auction without assigning any reason thereof. In case o

any dispute in tender/Auction, the decision of AO of IIFL-HFL will be final. 15 DAYS SALE NOTICE UNDER THE RULE 9 SUB RULE (1) OF SARFAESI ACT, 2002

The Borrower are hereby notified to pay the sum as mentioned above along with upto dated interest and ancillary expenses before the date of Tender/Auction, failing which the property will be auctioned/sold and balance dues if any will be recovered with interest and cost. Place:-Surat, Date: 09-Sep-2022 Sd/- Authorised Officer, IIFL Home Finance Limited

Public Notice For E-Auction For Sale Of Immovable Properties

Sale of Immovable property mortgaged to IIFL Home Finance Limited (Formerly known as India Infoline Housing Finance Ltd.) (IIFL-HFL) Corporate Office at Plot No.98, Udyog Vihar, Phase-IV, Gurgaon-122015. (Haryana) and Branch Office at:- Ananddham Complex, 1st Floor, Shop No.5,6,7, Bus Stand Road, Veraval - 362265 under the Securitisation and Reconstruction of Financial Assets an Enforcement of Security Interest Act, 2002(hereinafter "Act"). Whereas the Auhorized Officer ("AO") of IIFL-HFL had taken the possess sion of the following property/ies pursuant to the notice issued U/S 13(2) of the Act in the following loan accounts/prospect nos. with right to sell the same on "AS IS WHERE IS BASIS & AS IS WHAT IS BASIS" for realization of IIFL-HFL's dues, The Sale will be done by the undersigned through e-auction platform provided at the website: www.bankeauctions.com.

Borrower(s) / Co- Borrower(s) / Guarantor(s)	Demand Notice Date and Amount	Description of the Immovable property/ Secured Asset	Date of Physical Possession	Reserve Price	
1. Mr. Babubhai Govind Gadhiya 2. Mr.Divyesh Babubhai Gadhiya (Prospect No.861135 & 933110)	15-July-2021 Rs.16,27,091/- (Rupees Sixteen Lakh Twenty Seven Thousand Ninety One Only)	All that part and parcel of the property bearing 531, City Sr Block B, Northern Side admeasuring 284 sq feet Gola Sheri, Mota Kolivada, Nr Darji Wado, Veraval Patan, Veraval, 362265, Gir Somanth Gujarat,India.	Total Outstanding As	Rs.14,13,000/- (Rupees Fourteen Lakh Thirteen Thousand Only)	
	Bid Increase Amount		Rs.18,14,938/-(Rupees	Earnest Money Deposit (EMD)	
	Rs.25,000/-(Rupees Twenty Five Thousand Only)			Rs.1,41,300/-(Rupees One Lakh Forty One Thousand Three Hundred Only)	
Date of Inspection of property		EMD Last Date	Date/ Time of E-Auction		
04-Oct-2022 1100 hrs -1400 hrs.		07-Oct-2022 till 5 pm.	10-Oct-2022 1100 hrs-1300 hrs.		
Mode of Payment:- All payment shall be made by demand draft in favour of "IIFL Home Finance Limited" payable at Gurugram or through					

RTGS/NEFT The accounts details are as follows: a) Name of the account: - IIFL Home Finance Ltd., b) Name of the Bank: - Standard Charted Bank Ltd., c) Account No:-53105066294, d) IFSC Code:-SCBL0036025 or through Payment Link: https://quickpay.iiflfinance.com TERMS AND CONDITIONS:-

For participating in e-auction, Intending bidders required to register their details with the Service Provider https://www.bankeauctions.com, well in advance and has to create the login account, login ID and password. Intending bidders have to submit / send their "Tender FORM" along with the payment details towards EMD, copy of the KYC and PAN card at the above mentioned Branch Office. The bidders shall improve their offer in multiple of amount mentioned under the column "Bid Increase Amount". In case bid is placed in the last

5 minutes of the closing time of the auction, the closing time will automatically get extended for 5 minutes. The successful bidder should deposit 25% of the bid amount (after adjusting EMD) within 24 hours of the acceptance of bid price by the AO and the balance 75% of the bid amount within 15 days from the date of confirmation of sale by the secured creditor. All deposit and payment shall be in the prescribed mode of payment. The purchaser has to bear the cess, applicable stamp duty, fees, and any other statutory dues or other dues like municipal tax, electricity charges

land and all other incidental costs, charges including all taxes and rates outgoings relating to the property. Bidders are advised to go through the website https://bankeauctions.com and https://www.iifl.com/home-loans/properties-for-auction for detailed terms and conditions of auction sale & auction application form before submitting their Bids for taking part in the e-auction sale proceedings For details, help procedure and online training on e-auction prospective bidders may contact the service provider E mail ID: support@bankeauctions.com Support Helpline Numbers:@7291981124/25/26.and any property related query Mr. Jitendra Gupta @ 9999682823, Email ID:-jitendra.gupta1@iifl.com

Notice is hereby given to above said borrowers to collect the household articles, which were lying in the secured asset at the time of taking physical

possession within 7 days, otherwise IIFL-HFL shall not be responsible for any loss of property under the circumstances. Further the notice is hereby given to the Borrower/s, that in case they fail to collect the above said articles same shall be sold in accordance with Law 9. In case of default in payment at any stage by the successful bidder / auction purchaser within the above stipulated time, the sale will be cancelled and the amount already paid will be forfeited (including EMD) and the property will be again put to sale. 10. AO reserves the rights to postpone/cancel or vary the terms and condition of tender/auction without assigning any reason thereof. In case of any

dispute in tender/Auction, the decision of AO of IIFL-HFL will be final. STATUTARY 30 DAYS SALE NOTICE UNDER RULE 8 (6) OF THE SARFAESI ACT, 2002 The Borrower are hereby notified to pay the sum as mentioned above along with upto dated interest and ancillary expenses before the date of Tender/Auction, failing which the property will be auctioned/sold and balance dues if any will be recovered with interest and cost. Place:- Veraval, Date: 09-Sep-2022 Sd/- Authorised Officer, IIFL Home Finance Limite

indianexpress.com

The Indian **EXPRESS** ____JOURNALISM OF COURAGE ____

Public Notice For E-Auction Cum Sale (Appendix - IV A) (Rule 8(6)) Sale of Immovable property mortgaged to IIFL Home Finance Limited (Formerly known as India Infoline Housing Finance Ltd.) (IIFL-HFL) Corpora at Plot No.98,Udyog Vihar, Phase-IV, Gurgaon-122015. (Haryana) and Branch Office at:- Office No.701, 7th Floor, 21st Centuary Business Center Near Udhna Darwaja, Ring Road, Surat - 395002/407, 4th Floor, The Imperia, OppShashtri Maidan, Above Federal Bank, Nr.Axis Bank, Rajkot

360001 under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002(hereinafter "Act"). Whereas the Auhorized Officer ("AO") of IIFL-HFL had taken the possession of the following property/ies pursuant to the notice issued U/S 13(2) of the Act in the following lowing loan accounts/prospect nos, with a right to sell the same on "AS IS WHERE IS BASIS & AS IS WHAT IS BASIS" for realization of IIFL-HFL's due The Sale will be done by the undersigned through e-auction platform provided at the website: www.bankeauctions.com Description of the Immovable Demand Notice Date of Symbolic Reserve Price Borrower(s) / Guarantor(s) Date and Amount property/ Secured Asset 02-Dec-2021 15-July-2022 1Mr. Akash Patil Rs.8.50,000/-All that part and parcel of the prop-Sixteen Lakh Nine Thousand erty bearing Plot.No.69 Total Outstanding As (Rupees Eight Lakh Fifty 2. Mrs.Ashaben Patil Thousand Only) 3.Mr.Hiralal Shvamrav Four Hundred One Only) Admeasuring 40.15 Sq.Mtrs Aradhana Dream Vibhag-4, Block Rs.17,51,070/-(Rupees Patil Earnest Money Deposit (EMI Bid Increase Amount Rs.85,000/-No 161, Jolwa, Surat-394815, (Prospect Rs.20,000/-(Rupees Twenty One Thousand and (Rupees Eighty Five Surat, Gujarat, India, 394327. No.IL10010638) Thousand Only) Seventy Only) Thousand Only) All that part and parcel of the prop- Physical Possession Rs.7,50,000/-12-Mar-2022 erty bearing Flat No. A-305 Or (Rupees Seven Lakh Fifty 1.Mr. Dabalu Mishra. Rs.17,90,351.00/-The 3Rd Floor Admeasuring 421 Thousand Only) 2.Mrs.Poonam Dabalu (Rupees Seventeen Lakh 16-July-2022 Sq. Feet Super Built Up Area, & 305 Sq. Feet I.E.28.35 Sq. Mts Hundred Fifty One Only) Built Up Area, Along With 18.00 Total Outstanding As Earnest Money Deposit (EMD 3.0m Vegetable And Fruit Center Sq. Mts. Undivided Share In The On Date 02-Sep-2022 Rs.75,000/-Bid Increase Amount Land Of "Madhavpark Of Madhav Rs.18,92,350/-

Co. Op. Ho. Society Ltd.", Situate (Rupees Seventy Five (Rupees Eighteen Lakh (Prospect No 920875 Rs.20,000/-At Revenue Survey No. 162/3, T P. Scheme No. 13 (Adajan) Ninety Two Thousand and 777813) (Rupees Twenty Thousand Only) Thousand Only) Three Hundred Fifty Surat-395009, Gujarat, India . All that part and parcel of the prop- Physical Possession Rs.16,00,000/-05-July-2018 1.Mrs. Kavita Jateen (Rupees Sixteen Rs.22,19,556/- (Rupees Twenty erty bearing Office No.805 and 30-Apr-2022 Lakh Only) Two Lakh Nineteen Thousand 806, on 8th Floor, City Survey-Total Outstanding As Five Hundred Fifty Six Only) Ward No.7, City Survey No. Earnest Money Deposit (EMI 2. Mr. Jateen On Date 07-Sep-2022 2385/1, Shilp Tower, Godowi Rs.47,36,262/-(Rupees Bid Increase Amount Road, Tagore Road, Bhaktinagar Forty Seven Lakh Thirty Chandrakant Doshi Rs.1,60,000/-Rupees One Lakh Sixty (Prospect No. 764666) Rs.25,000/-(Rupees Twenty Rajkot, Gujarat-360002. Six Thousand Two Thousand Only) Five Thousand Only) (Admeasuring 621 Sq.Ft.) Hundred Sixty Two Only Date/ Time of E-Auction Date of Inspection of property **EMD Last Date** 19-Sep-2022 1100 hrs -1400 hrs 21-Sep-2022 till 5 pm. 23-Sep-2022 1100 hrs-1300 hrs. Mode of Payment:- All payment shall be made by demand draft in favour of "IIFL Home Finance Limited" payable at Gurugram or through

RTGS/NEFT The accounts details are as follows: a) Name of the account:- IIFL Home Finance Ltd., b) Name of the Bank:- Standard Charte Bank Ltd., c) Account No:-53105066294, d) IFSC Code:-SCBL0036025 or through Payment Link: https://quickpay.iiflfinance.com TERMS AND CONDITIONS:-For participating in e-auction, Intending bidders required to register their details with the Service Provider https://www.bankeauctions.com, well

advance and has to create the login account, login ID and password. Intending bidders have to submit / send their "Tender FORM" along with the parent details towards EMD, copy of the KYC and PAN card at the above mentioned Branch Office. 2. The bidders shall improve their offer in multiple of amount mentioned under the column "Bid Increase Amount". In case bid is placed in the

 The bidders shall improve their oriential time of an industrial time to be did in the last of the closing time of the auction, the closing time will automatically get extended for 5 minutes.
 The successful bidder should deposit 25% of the bid amount (after adjusting EMD) within 24 hours of the acceptance of bid price by the AO and the balance 75% of the bid amount within 15 days from the date of confirmation of sale by the secured creditor. All deposit and payment shall be in the prescribed mode of payment. The purchaser has to bear the cess, applicable stamp duty, fees, and any other statutory dues or other dues like municipal tax, electricity charges

land and all other incidental costs, charges including all taxes and rates outgoings relating to the property. Bidders are advised to go through the website https://bankeauctions.com and https://www.iifl.com/home-loans/properties-for-auction for detailed terms and conditions of auction sale & auction application form before submitting their Bids for taking part in the e-auction sale proceedings For details, help procedure and online training on e-auction prospective bidders may contact the service provider E mail ID:- support@bankeauctions.com Support Helpline Numbers:@7291981124/25/26.and any property related query Mr.Jitendra Gupta @+91-9999682823 Email:- jitendra.gupta1@iifl.com Notice is hereby given to above said borrowers to collect the household articles, which were lying in the secured asset at the time of taking physical

possession within 7 days, otherwise IIFL-HFL shall not be responsible for any loss of property under the circumstances.

 In case of default in payment at any stage by the successful bidder / auction purchaser within the above stipulated time, the sale will be cancelled an
the amount already paid will be forfeited (including EMD) and the property will be again put to sale. 10. AO reserves the rights to postpone/cancel or vary the terms and condition of tender/auction without assigning any reason thereof. In case of any dispute in tender/Auction, the decision of AO of IIFL-HFL will be final.

Further the notice is hereby given to the Borrower/s, that in case they fail to collect the above said articles same shall be sold in accordance with Law

15 DAYS SALE NOTICE UNDER THE RULE 9 SUB RULE (1) OF SARFAESI ACT, 2002 The Borrower are hereby notified to pay the sum as mentioned above along with upto dated interest and ancillary expenses before the date of Tender/Auction, failing which the property will be auctioned/sold and balance dues if any will be recovered with interest and cost. Place:-Surat, Date: 09-Sep-2022 Sd/- Authorised Officer, IIFL Home Finance Limited

Ahmedabad

financialexp.epapr.in

The Indian Express. For the Indian Intelligent.

Inform your opinion detailed analysis.

I arrive at a conclusion not an assumption.

ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો, પગપાળા આવતા પદયાત્રીઓ દર્શન કરી ધન્ય બન્યાં

પવિત્ર અને પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રધ્ધાનાં ઘોડાપૂર ઉમટ્યાં છે. ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો છે. દૂર દૂરથી પગપાળા યાત્રા કરીને અંબાજી આવીને માઈભક્તો માં અંબેના દર્શન કરીને ધન્ય બન્યાં છે. અંબાજી જતા તમામ રસ્તાઓ ઉપર ભરચક માનવપ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ આગળ વધી રહ્યો છે. રસ્તાઓ ઉપર ઘણી જગ્યાએ ગરબાની રમઝટ જોવા મળે છે. માતાજીના આ પવિત્ર અને દિવ્ય પ્રસંગમાં ઘણા માઈભક્તો ગરબામાં જોડાઈ જાય છે અને ગરબા રમીને માતાજીની આરાધના કરે છે.

હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ, ઉલ્લાસ સાથે લાખો માઈભક્તોના આગમનથી અંબાજી જાણે કે વધુ સોહામણું બન્યું છે. દર્શન કરીને પરત ફરતા માઈભક્તોના કપાળે કુમકુમ તિલક, હાથમાં ચુંદડી અને પ્રસાદ તથા મોં પર ધન્યતા, આનંદ અને સંતોષ જોવા મળે છે. દિવસોથી રાત-દિવસ ચાલીને અંબાજી પહોંચેલા શ્રધ્ધાળુઓ સુખ-સંતોષરૂપ અંબાજીની યાત્રા સંપન્ન કરી પરત ફરી રહ્યાં છે.

ક્લેક્ટર આનંદ પટેલ મેળાની પરિસ્થિતિ અને યાત્રિકોની સુવિધાઓ પર સતત કાળજી અને વૉચ રાખી રહ્યાં છે. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સેવાભાવ સાથે ખડેપગે સેવામાં રહે છે. લાખો યાત્રિકો અંબાજીમાં સરસ સ્વચ્છતા જોઈને જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની સરાહના કરી રહ્યાં છે. દર્શન માટે અંબાજી મંદિર પરિસરમાં સારી વ્યવસ્થા હોવાથી યાત્રિકોની લાંબી લાઈનો છતાં કોઈને લાંબો સમય લાઈનમાં ઉભા રહેવું પડતું નથી. પ્રસાદ કેન્દ્રો પુરતી સંખ્યામાં હોવાથી યાત્રિકોને કોઈ તકલીફ પડતી નથી.

ભાદરવી મહામેળા પ્રસંગે અંબાજી ચાલતા-પદયાત્રા દ્વારા જવાનો ખાસ મહિમા છે. આઘશક્તિ માં અંબે શક્તિ સ્વરૂપ હોવાથી ચાલીને, કષ્ટ વેઠતા અંબાજી જવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે તેવી માન્યતા



અંબાજીનો મહામેળો સોળે કળાએ જામ્યો છે. મંદિરના આસપાસ અદુભૂત રોશની કરવામાં આવતા યાત્રાળુઓમાં ખુશી ફેલાઈ છે. (તસ્વીર : સિતાબ કાદરી - પાલનપુર)

આથી નવરાત્રિમાં પોતાના ગામની માંડવડીમાં રમવા પધારવા માતાજીને આમંત્રણ આપવા માઈભક્તો ચાલતા અંબાજી આવે છે.

અંબાજી તીર્થસ્થાન બહુ પ્રાચીન સમયથી હોવાનો પુરાણો અને

માતાજીના સ્થાનકે આવ્યાં હોવાનો

પુરાણોમાં ઉલ્લેખ છે. શ્રીકૃષ્ણનું ચૌલકર્મ અંબાજીમાં થયાની માન્યતા છે. પાંડવો વનવાસ દરમ્યાન અંબાજી નજીક કોટેશ્વરમાં રોકાયા હોવાનું કહેવાય છે.

બહુ પ્રાચીન અને પ્રાણા

વિશાળ ભવ્ય મહેલ અને તેમાં સોનાના હિંચકા ઉપર ઝૂલતી સ્વરૂપવાન દિવ્ય તેજસ્વી સ્ત્રીને જોઈને ચરાઈ વધારે મળશે તેવી રબોરીને લાલચ થઈ હતી. તેણે સુપડું ભરીને આપેલા જવ તો લઈ લીધા રસ્તામાં તેણે ગુસ્સામાં પોટલામાં બાંધેલા જવ ફેંકી દીધા. રબારીએ ઘરે આવીને તેની પત્નીને વાત કરી અને જોયું તો કપડાંમાં જવ બાંધ્યા હતા તેમાં બે-ત્રણ હીરા ચોંટેલા હતા.

રબારીને તેની ભૂલનું ભાન થયું. પછી રબારી અને તેની પત્નીએ મહેલને શોધવા નિકળ્યાં. ઘણા દિવસો સુધી તેઓ ૨ખડ્યાં ક્યાય મહેલ યાત્રાધામ અંબાજી વિશે ધર્મગ્રંથો 📑 કે એ જગ્યા ના મળી. થાકેલા રબારી પતિ-પત્ની ડુંગારમાં રડવા માંડ્યા

હાથમાં ધજા, મનમાં ભક્તિ અને ઉલ્લાસ સાથે લાખો માઈભક્તો આવતા અંબાજી સોહામણું બન્યું

અને પુરાણોમાં વિસ્તૃત ઉલ્લેખ છે તોમજ ઘણી લોકકથાઓ, માન્યતાઓ છે. એમ કહેવાય છે કે સદીઓ પહેલાં ગબ્બર વિસ્તારમાં એક રબારી ગાયો ચરાવવા જાય ત્યારે એક ગાય બહારથી આવી તેની ગાયોમાં સામેલ થઈ જતી અને સાંજે પાછી જતી રહેતી. એક દિવસ રબારીને વિચાર આવ્યો કે, ગાયની ચરાઈ લેવા જવું છે. આથી તે

ગાયની પાછળ પાછળ ચાલ્યો, ઘણું ચાલ્યા પછી એક વિશાળ મહેલ આવ્યો તેમાં એક સ્ત્રી હિંચકા ઉપર ઝૂલતાં હતાં. તેમણે રબારીને ચરાઈ

કે, હે માં… અમને દર્શન આપો, ત્યારે માતાજીએ પ્રગટ થઈ દર્શન આપ્યાની માન્યતા છે.માતાજીનું મૂળ પ્રાગટ્ય સ્થાન ગબ્બર હોવાની માન્યતા છે. અંબાજી આવતા યાત્રિકો પૈકી ઘણા યાત્રિકો નિયમિત ગબ્બર દર્શન કરવા જાય છે.તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી ગબ્બર ખાતે માતાજીના તમામ સ્વરૂપો સમાન પ૧ શક્તિપીઠોનાં મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. શક્તિપીઠોના અસલ મંદિરો જેવા જ મંદિરો ગબ્બર પરિક્રમા પથ ઉપર બનાવાયા છે તેમજ અસલ મંદિરોમાં જેવી પુજા થાય છે તેવી જ પુજા અહીં થાય છે.

તાજેતરમાં અંબાજી ગબ્બર ખાતે રૂા.૧૩.૩૫ કરોડના ખર્ચે નવનિર્મિત સૌથી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ કરવામાં આવતાં આ વર્ષે મેળામાં યાત્રિકો અને દર્શનાર્થીઓના આકર્ષણ માટે લાઈટ સાઉન્ડ શૉનું નવું નજરાણું ઉમેરાયું છે.

૨૨ હજારથી વધુ લોકોએ મતદાર યાદીમાં નોંધ કરાવી

પાટણમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશને મળતો બહોળો પ્રતિસાદ

રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા હાલમાં મતદારયાદી સુધારણા અધ્યક્ષ કેજરીવાલની અનુમતિથી કરવા બદલ શ્રેષ્ઠ શિક્ષક તરીકે કાર્યક્રમ ચાલી રહ્યો છે જેને બહોળો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા ત્રીજા પ્રશસ્તિ પત્ર એ નાયત કરી પ્રતિસાદ મળી રહ્યો છે. પાટણ તબક્કાના ૧૦ ઉમેદવારોની સન્માનિત કરવામાં આવ્યાં હતાં. જિલ્લો મતદારયાદીમાં નામની જાહેરાત કરી છે. જેમાં પાટણ નોંધણી કરાવવાની ઝૂંબેશમાં વિધાનસભાનાં ઉમેદવાર તરીકે અગ્રેસર છે. અત્યાર સુધીમાં કુલ પાટણ શહેર કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ ૨૨,૩૦૯ જેટલા લોકોએ અને પાટણ નગરપાલિકાના પૂર્વ ખાતે શ્રી ગજાનન મંડળી દ્વારા ચાલુ મતદારયાદીમાં નામની નોંધણી કરાવી છે. જેમાં જિલ્લાના યુવાઓએ 92,668

મતદારયાદીમાં પોતાના નામની

નોંધણી કરાવી છે.

જેલોકો પ્રથમવાર મત આપવા ઉપપ્રમુખની સાથે સાથે અનેકવિધ મજબૂત બનાવી રહ્યાં છે. આ છે. મતદાર સુધારણા કાર્યક્રમમાં ચૂંટણી શિક્ષક વિપુલ પ્રજાપતિનું સન્માન કાર્ડનું આધારકાર્ડની સાથે લીન્કીંગ, મતદારયાદીમાંથી નામ કમી કરાવવું

સિધ્ધપુર ગોકુલ યુનિવર્સિટી દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાયો

સિધ્ધપુર, તા.૮ અંબાજી જતા પદેયાત્રીઓ માટે સિધ્ધપુર ખાતે આવેલ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા મેડીકલ કેમ્પ તેમજ ભક્તો માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેનું જયેશભાઈ પંડચાના હસ્તે રિબીન કાપી શુભારંભ કરવામાં આવ્યો કાવા શુભારલ કરવાના એ તે કરો શુભારલ કરવાના એ તે આથી અમે નિતિનભાઈ કરણાશંકર બલવંતસિંહ રાજપૂતના નિર્દેશથી પંડયા, રહેઠાશ - મુંબઈ ના તે આથી પ્રતિવર્ષ સેવા કેમ્પ કરવામાં આવે જાહેર જાહેર નોટીસ / જાહેર ચેતવણી અપી જાહેર જનતા તથા લાગતા વળગતા તમામને ચેતવણી આપીએ છે કે પ્રતિકાશ કરિતાના છે. પટેલ , અશોકભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં

ભિલોડામાં આજે ગણેશનું હાથમતિમાં વિસર્જન કરાશે

અનંત ચૌદશના પવિત્ર દિને અરવલ્લી જીલ્લાના ચોકમાંથી ગણેશજીની વાજતે-હાથમતી નદીમાં વહેતા જળમાં વિસર્જન કરાશે તેમ સતિષભાઇ શાહ, ભરતભાઇ ત્રિવેદી સહિત આયોજકોએ <u>લેશો.</u>

જણાવ્યું હતું.

૧૮થી ૧૯વર્ષની વયજૂથના ૧૨૯૯૪ યુવાનોએ નામ નોંધાવ્યું

જઈ રહ્યાં છે તેવા લોકો નામની સંસ્થાઓ સાથે સંકળાયેલા લાલેશ નોંધણી કરાવીને લોકશાહીને ઠક્કરની પસંદગી કરવામાં આવી

કરાયું

મહર્ષિશ્રી અરવિંદની ૧૫૦મી તેમજ યાદીમાં કોઈ પ્રકારના સુધારા જન્મ જયંતી નિમિત્તે યોગાંજલી ટ્રસ્ટ કરાવવા વગેરેનો સમાવેશ થાય છે. સિધ્ધપુર સંચાલિત અરવિંદ યોગ પાટણ જિલ્લામાંથી ૬,૬૩૮ કેન્દ્ર દ્વારા કરલીના વતની અને લોકોએ મતદારયાદીમાં સુધારો પી.જે.એ. એન્ડ આર. કે. શાહ ગર્લ્સ હાઈસ્કૂલ, સિધ્ધપુરના ગણિત-વિજ્ઞાન શિક્ષક વિપુલકુમાર મોતીલાલ પ્રજાપતિને લેખિકા અને મહર્ષિ અરવિંદના સંધિકા જયોતાબેન થાનકીના હસ્તે બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે સહઅભ્યાસીક

જાહેર નોટીસ / જાહેર ચેતવણી



આ ફોટાવાળા અંકિતકુમાર નિતિનભાઈ પંડયા (હાલ રહેઠાણ અમોને ખબર નથી) અમોના દીકરા થાય છે અને છેલ્લા ઘશા લાંબા સમયથી તેઓ પોતાની પત્ની સાથે અલગ ભાડાના મકાનમાં રહેતા આવેલ અને અમોના દીકરા અંકિતકુમાર નિતિનભાઈ પંડયા છેલ્લા બે વર્ષ ઉપરાંતથી તેઓના અંગત જીવનના કારણે કામધંથો કરતા ન હોઈ તેમજ આમરા કહયામાં ન હોઈ તેમજ અમો ભિલોડા તા. ૮ લારા અંકિતકુમારના ઘરસંસાર બાબતે ભાદરવા સુદ, ચૌદશ અને અંક્તિકુમાર નિતિનભાઈ પંડયા અમારો દીકરો પોતાન અંગત નિર્ણયથી ગત તા. ૧૬.૮.૨૦૨૨ ના રોજ અમોને મેસજ છોડીને અમોને કહયા વગર ક્યાંક જતા ભિલોડાના મેઇન બજાર રહેલ છે. તેમજ અમો દ્વારા તેનો સંપર્ક વિસ્તારમાં આવેલ ખાડીયા કરવા મયુન કરવા છતાં તેઓ અમોને સાચી હકીકતથી વાકેક કરતા ન હોઈ જેથી અમો દ્વારા ના ઈલાજે હાલની જાહેર ગાજતે અબીલ, ગુલાલની નોટીસ / જાહેર યેતવણી આપી જાહેર જનતા જાણ કરીએ છીએ કે અમારો છોળો વચ્ચે ભક્તિભાવપૂર્વક શ્રુધ્ધાભેર શોભાયાત્રા નીકળ્યા જે કાંઈ પશ સ્થાવર તથા જંગમ મિલ્કતો આવેલ છે તેમાંથી તેઓને બેદખલ કરેલ બાદ ગણપતી બાપાની મુર્તીનું છે જેથી આ ફોટાવાળા આમારા દીકરા સાથે અમોના નામથી કોઈ જ નાણાં કીય, આર્થીક કે સામાજીક વ્યવહારો કરવા નહી તેમ છતાં કોઈ વ્યક્તિ દ્વારા આવા વ્યવહાર કરશે તો તેની કોઈપણ જબદારી અમોની રહેશે નહીં તેની સ્પષ્ટપણે નોંધ

નિતિનકુમાર કરૂશાશંકર પંડયા

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય શિક્ષક તરીકેની ઉત્તમ ફરજ અદા

ગણેશ ઉત્સવમાં ભજન સંધ્યા

પાટણ શહેરની ગણેશવાડી

યોજાઈ

પ્રદિપસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં

વર્ષે ૧૪૫માં ગણેશોત્સવની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ગણેશવાડી ખાતે પાટણના મ્યુઝિકલ ક્લબના કલાકાર સંદિપ ખત્રી, અનિતા ખત્રી દ્વારા ભક્તિ ગીતોની રમઝટ મચાવી

રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૧થી ૧૨ નાં વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.તેમજ શાળાના તમામ બાળકોને આચાર્ય પ્રદિપસિંહ ચૌહાણ, આચાર્ય ભિખુજી હડિયોલ વગેરેએ પ્રોત્સાહિત કર્યા

હતા.કબ્બડી,સંગીત ખુરશી, ગોળા ફેંક, ચક્ર ફેંક, ખોખો, વગેરે રમતોમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ૨મત–ગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રમુખ ડૉ.જસવંત સિંહ જાડેજાએ ઉદ્બોધનમાં જણાવ્યું હતું. વરસડામાં પૂજા પાઠનું આયોજન કરાયું વરસડા દૂધ ઉત્પાદક સહકારી

મંડળી તથા વરસડા ગ્રામજનો દ્વારા

જાડેજાની અધ્યક્ષતામાં, આચાર્ય

લોક કલ્યાણ અને લમ્પી વાયરસ નેશનલ ઈન્સ્યુરન્સ વીમોસેવા સફકારી મંડળી લી. 'ચંદાનિવાસ', ક્રાર્ટાવતી હોસ્પિટલ સામે, ટાઉન હોલ પાસે, એલીસબ્રીજ, અમદાવાદ-૬.

આથી, તમામ સભ્ય, સહકારી મંડળીઓ, ટ્રસ્ટ, સંગઠનો (ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, બિહાર) તથા સર્વે વ્યક્તિગત સભ્યોને (૫ રાજ્યોમાં) જણાવવાનું કે, નેશનલ ઈન્સ્યુરન્સ વીમોસેવા સઠકારી મંડળી લી. અમદાવાદની વર્ષ ૨૦૨૨ ની વાર્ષિક સાધારણ સભા તા. ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૨, શનિવાર, સમગ્ર : બપોરે ૨:00 વાગે રાખવામાં આવેલ છે. તેમાં આપ સર્વે ને આમંત્રણ છે. તારીખ : ૦૯.૦૯.૨૦૨૨ બોર્ક ઓફ કિરેક્ટર્સના આદેશથી આશાબેન અજમેરી - પ્રમુખ

નોટિસ મેસ્સેર્સ યુ.પી.એલ લિમિટેડના સરલા બેહરાનીને નામે રહેલા ચુ.પી.એલ લિમિટેડ ઈકવીટી શેરો સર્ટિફિકેટ નંબર ૧૮૨૧૧૦ અને ડિસ્ટંક્ટિવ નેંબર ૫૫૪૪૪૩૮૫ - ૫૫૪૪૪૫७૨ થી સર્ટિફિકેટ ખોવાયા છે / ગુમ થયા છે અને તેથી કંપનીને આ શેરો માટે કુપ્લીકેટ સર્ટિફિકેટ ઈસ્યું કરવા માટેની અરજી મળી છે. કોઈ પણ વ્યક્તિને ઉપરોક્ત શેરોની બાબતે દાવો હોય તો તેને કંપનીની રજીસ્ટર્ડ ઓફીસ 3-૧૧ જી.આઈ.ડી.સી. વાપી, વલસાડ, ગુજરાત - ૩૯૬૧૯૫ ખાતે આ નોટીસની પ્રસિધ્ધિની તારીખથી પંદર દિવસમાં દાવો નોંધાવવો, નહિ તો કંપની કોઇપણ વધુ જાણ કર્યા સિવાય કુપ્લીકેટ સર્ટિફિકેટ ઈસ્થુ કરવાની કાર્યવાહી કરશે. स्थण - अमहावाह

તારીખ - ૦૯-૦૯-૨૦૨૨

શેર હોલ્ડરનું નામ સરલા બેહરાની



ક्छला नोटीस (स्थावर भिबङ्त भाटे) ખાથી નીચે સહી કરનાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સી.જી. રોડ શાળા, અમદાવાદ ના અધિકૃત અધિકારી સીક્વોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સીક્વોરિટી એક્ટ, ૨૦૦૨ અને તેની સાથેની સત્તાને સેક્શન ૧૩(૧૨) સાથે સીક્યુરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રુલ્સ, ૨૦૦૨ના રુલ -૩ જે લા.૩૦.૦૬.૨૦૧ ના રોજ રીખાર્ડ નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે. તે માટે મેસર્સ સુપર નીવા આઈએનસી અને શ્રી ઈશ્વરભાઇ ખેમાભાઇ પટેલ (પ્રોપરાચટર/ જામીનદાર) શ્રીયતી વદુબેન કાનારામ ચૌધરી જામીનદાર અને શ્રી કાનાભાઇ ખેમાભાઇ ચૌધરી ત્રમીનદાર ને નોટિસમા જણાવવામાં આવે છે કે રૂા. ૨,૮૦,૩७,૦૯૭.૫૦ (અંકે રૂપિયા બે કરોક એંસી લાખ સાકગીસ **હજાર સતાણું અને પચાસ પૈસા પુરા)** એ તા. ³0. **૦૬. ૨૦૨૨** શ્રી વ્યાજ અને ચડત વ્યાજ અને ખર્ચ વગેરે સહીત આ નોટિસની રીસિપ્ટની તારીખશી ૬૦

દિવસમાં ચૂકવવાના થાય છે. દૈવાદાર ૨કમ પરત ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હોવાથી, દેવાદાર અને સામાન્ય જનતાને આ નોટિસ આપવામાં આવે છે કે કથિત અધિનિયમની સબ કલમ (૪) નિયમ૧૩ તેના નિયમ ૮ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ રૂલ્સ ૨૦૦૨, સાથે ધ્યાનમાં લીધા બાદ, પોતાને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને, વર્ષ ૨૦૨૨ના સપ્ટેમ્બર ના આ ૬ દિવસે, નીચે સહી કરનારે અહી વર્ણવેલ મિલ્કતનો સાંકેતિક કબજો મેળવ્યો છે.

આથી ખાસ કરીને દેવાદાર,અને સામાન્ય રીતે જાહેર જનતા અને જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે કોઈપણ જાતનો વ્યવહાર ના કરાવવાની ચેતવણી આપવામાં આવે છે. સંબંધિત મિલકત અંગે કોઇ પણ પ્રકારનો વ્યવહાર કરવામાં આવશે તો તે સ્ટેટ બેંક ઓક ઈન્ડિયાના બાકી લેણા ફા. ૨,૮૦,૩૦,૦૯৬.૫૦ (અંકે રૂપિયા બે કરોક ઍસી લાખ સાડગીસ કુજર્ સતાણું અને પચાસ પૈસા પુરા) તા.૩૦-૦૬-૨૦૨૨ અને વ્યાજ અને

સરફેસી કાયદાની કલમ ૧૩ની પેટા કલમ ૮ની જોગવાઈ પ્રત્યે દેવાદારોનું મિલકત છોડાવવા માટે મળવા પાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે.

સ્થાવર મિલકતની વિગત :

રહેણાંક મિલકતના તમામ હક અને હિસ્સા સાથે,ફલેટ નં. બી/૧૦૪, પેહેલો માળ, બ્લોક નં. ''બી''૭૨૨ જેનું ક્ષેત્રકળ ૧૪૮.૮૩ ચો.મી.,સુપર બિલ્ટઅપ એરીયા સાથે વણ વહેંચાયેલ હિસ્સા સાથે ક્ષેત્રફળ ૪૯.૨૦ ચો.મી. જે ''કેસર હાઈટ્સ'' ના નામે જાણીતી સ્ક્રીમ પર બીન ખેતીનીજમીનના સર્વે નં. ૧૦૪૨, એલોટેડ ફાઈનલ પ્લોટ નં. લ્ ૩ પર ટાઉન પ્લાનીંગ સ્ક્રીમ નં. ૧૧૩ ના મૌજે વસ્ત્રાલ, તાલુકો વટવા, જી. અમદાવાદ. ગુજરાત. જેની ચર્તુસીમા : ઉત્તરઃ ફલેટ નં. બી ૧૦૫, દક્ષિણ: સોસાયટી ક્રોમન રોડ, પૂર્વ :ટીપી રોડ, પશ્ચિમઃ ફ્લેટ નં. બી૧૦૩

તારીખ : ૦૬-૦૯-૨૦૨૨

અધિકૃત અધિકારી ભારતીય સ્ટેટ બેંક


દાઉદી વ્હોરા ટ્રસ્ટના ટ્રસ્ટીઓનું સન્માન કરાયું ગોળા ફેંક, ચક્રફેક જેવી સ્પર્ધા યોજાઇ કેશરબા જાડેજા વિદ્યા સંકુલમાં કાણોદર હાઇસ્ક્લમાં વિજ્ઞાન પ્રવાહને શાળાકિય રમતોત્સવ યોજાયો ૨૫ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાઇ વડગામ તા.૮ રોગચાળો નાબૂદ થાય તે હેતુથી ગુરુ કેશરબા જાડેજા વિદ્યા સંકુલ મહારાજની પૂર્જા પાઠઅને વિષ્ણુ પાઠ


એસ.કે.એમ.હાઇસ્કુલ ખાતે વિજ્ઞાન પ્રવાહ વિભાગને પચીસ વર્ષ પૂર્શ થતાં સર્વોદય કેળવણી મંડળ દ્વારા રજતજયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે દાઉદી વ્હોરા વેલ્ફેર ટ્રસ્ટ મુંબઇના

સન્માન કરવામાં આવ્યું હતું. કાશોદર સર્વોદય કેળવણી મંડળ સંચાલિત એસ.કે.એમ.હાઇસ્કુલ ખાતે શિક્ષકદિનની ઉજવણી સાથે

ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેતા તેઓનું

વિજ્ઞાન પ્રવાહ વિભાગને પચીસ





પેટે સુપડું ભરીને જવ આપ્યા હતા.

વડગામ તાલુકાના વરસડા દૂધ

ઉત્પાદન સહકારી મંડળી તથા

વરસડા ગ્રામજનો દ્વારા વિશ્વના

તમામ જીવોના કલ્યાણ માટે તથા

લમ્પી વાયરસ નેસ્તનાબૂદ થાય તે

હેતુથી ગુરુ મહારાજના મંદિર સંકુલમાં

ગુરુ મહારાજની પૂજા પાઠ અને

વિષ્ણુપાઠનું આયોજન કરવામાં આવ્યું

હતું.બનાસકાંઠા જિલ્લા પંચાયત

ડેલીંગેટ ફ્લજીભાઇ વિ.પટેલ તથા

ગ્રામજનો દ્વારા કાર્યક્રમનું સંચાલન

કરવામાં આવ્યું હતું.

વડગામ ખાતે પ્રમુખ ડૉ.જસવંતર્સિંહ કરવામાં આવ્યો હતો દરમિયાન

૪૮મી વાર્ષિક સાધારણ સભાની નોટીસ

આથી બેંકના તમામ સભાસદોને જણાવવામાં આવે છે કે બેંકની ૪૮મી વાર્ષિક સાધારણ સભા તા. ૨૬-૯-૨૦૨૨, સોમવારના રોજ સવારે ૧૧ કલાકે, ૩૦૯, સાકાર-૨, એલિસબ્રીજ, અમદાવાદ-૬ મુકામે મળશે. જેમાં સમયસર હાજર રહેવા વિનંતી છે.

41. OC-OC-5055 અમદાવાદ.

મેનેજીંગ ડિરેક્ટર બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સૂચનાથી.

ગૌતમ જેમ્સ લિમિટેડ CIN: L36911GJ2014PLC078802

રજીસ્ટર્ડ ઓફિસ ઃ ત્રીજો માળ, ઓફિસ - ૩૦૧, સુમુખ સુપર કમ્પાઉન્ડ, વસા દેવડી રોડ, સુરત - ૩૯૫૦૦૪ Email- complianceggl@gmail.com Phone No.: 0261-2538046, Website : www.gautamgems.com

લ્મી વાર્ષિક સામાન્ય સભાની નોટિસ આથી નોટિસ આપવામાં આવે છે કે ગૌતમ જેમ્સ લિમિટેડના સભ્યોની ૯મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) ગુરૂવાર, ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ બપોરે ૩.૦૦ વાગે કંપનીની રજીસ્ટર્ડ ઓફિસ ત્રીજો માળ, ઓફિસ-૩૦૧, સુમુખ સુપર કમ્પાઉન્ડ, વસ્તા દેવડી રોડ, સુરત -૩૯૫૦૦૪ ખાતે એજીએમ ની નોટિસમાં જૈક્ષાવ્યા મુજબના વ્યવસાયનો વ્યવહાર કરવા માટે મળશે. કંપનીએ ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ ના વાર્ષિક અહેવાલ સાથે અએજીએમ ની નોટિસ માત્ર ઈલેક્ટ્રોનિક મોડ દ્રારા એવા સભ્યોને મોકલી છે કે જેમના ઈમેઈલ આઈડી કંપની/ડિપોઝિટરીમાં નોંધાયેલ છે કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્રારા મે ૦૫, ૨૦૨૦ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર તારીખ એપ્રિલ ૦૮, ૨૦૨૦, એપ્રિલ ૧૩, ૨૦૨૦ અને જાન્યુઆરી ૧૩, ૨૦૨૧ના પરિપત્ર સાથે વાંચો અને મે ૧૨, ૨૦૨૦ના સેબીના પરિપત્ર જાન્યુઆરી ૧૫,

૨૦૨૧, ડીસેમ્બર ૦૮, ૨૦૨૧ અને મે પ, ૨૦૨૨ સાથે વાંચો. કંપની ધારા, ૨૦૧૩ની કલમ ૧૦૮ મુજબ કંપનીઝ (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) નિયમો ૨૦૧૪ ના નિયમ ૨૦, સેબીના નિયમન ૪૪ (લિસ્ટીંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રિક્વાયરમેન્ટર્સ) રેગ્યુલેશન્સ ૨૦૧૫ એને સેક્રેટરીયલ સ્ટાન્ડર્ડ ("SS-2") ઈન્સ્ટીટયુટ ઑફ કંપનીઝ સેક્રેટરી ઑફ ઈન્ડિયા દ્રારા જારી કરવામાં આવેલ કંપની તેના તમામ સભ્યોને ઈલેક્ટ્રોનિક માધ્યમો (ઈ-વોટિંગ)નો ઉપયોગ કરીને એજીએમ ની નોટિસમાં નિર્ધારિત તમામ ઠરાવો પર પોતાનો વોટ આપવા માટે સુવિધા પુરી પાડે છે. NSDL દ્રારા પુરી પાડવા માં ઈલેકટ્રોનિક વોટિંગ સિસ્ટમ સભ્યોના મતદાન અધિકારો ગુરૂવાર, સપ્ટેમ્બર ૨૦, ૨૦૨૨ (કટ ઑફ તારીખ) ના રોજ કંપનીના પેઈડઅપ ઈકિવટી શેરમાં તેમના દ્રારા રાખવામાં આવેલા ઈકિવટી શેરના પ્રમાણ માં હોવા જોઈએ. જે મુજબ વિગતો જરૂરી છે. કંપની અધિનિયમ ૨૦૧૩ની જોગવાઈ અને તેના હેઠળ બનાવેલા નિયમો નીચે આપેલા છે.

૧) બુક બંધ કરવાનો સમયગાળો ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ શરૂ થશે અને ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ સમાપ્ત થશે (બંને દિવસો સહિત) ર) રિમોટ ઈ-વોટિંગનો સમયગાળો સોમવાર, રદ્દ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ

સવારે ૭.૦૦ વાગે શરૂ થશે અને બુધવાર, ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ સાંજે ૩) ઈ-વોટિંગના અધિકારો નકકી કરવા માટેની કટ ઓંક તારીખ ગુરૂવાર, સપ્ટેમ્બર

૪) સભ્યોને ઉપરોક્ત ઉલ્લેખિત સમયગાળા પછી રિમોટ ઈ-વોર્ટિંગ દ્રારા મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે નહી.

પ) શેરહોલ્ડર કંપનીનો હિસ્સો મેળવે છે અને નોટિસ મોકલ્યા પછી અને કટ ઑફ તારીખે શેર હોલ્ડ કર્યા પછી કંપનીના સભ્ય બને છે તેઓ તેમના મતદાન અધિકારોનો ઉપયોગ કરવા માટે એજીએમની નોટિસમાં ઉલ્લેખિત પગલાંને અનુસરી શકે છે. *) જે સભ્યોએ એજીએમ પહેલા રિમોટ ઈ-વોટિંગ દ્રારા તેમનો વોટ આપ્યો છે તેઓ પણ એજીએમ માં હાજર રહી શકે છે / ભાગ લઈ શકે છે પરંતુ તેઓ ફરીથી તેમનો વોટ આપવા માટે હકદાર નથી.

૭) બોર્ડે મેસર્સ શિખા પટેલ એન્ડ એસોસિએટસ, પ્રેકિટસિંગ કંપની સેક્રેટરી ઈ-વોટિંગ પ્રક્રિયાની ચકાસણી કરવા માટે સ્ક્રુટિનાઈઝર તરીકે કામ કરશે જેઓ વોટિંગના પરિજ્ઞામો ચેરમેન ને સબમિટ કરશે.

૮) રિમોટ ઈ-વોર્ટિંગને લગતી કોઈપણ પ્રશ્નો / ફરિયાદોના કિસ્સામાં તમે શેરધારકો માટે વારવાર પુછાતા પ્રશ્નો (FAQs) અને હેલ્પ સેકશન હેઠળ www.evoting.nsdl.com પર ઉપલબ્ધ શેરધારકો માટે ઈ-વોટિંગ વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લઈ શકો છો અથવા helpdesk@cdslindia.com ઉપર ઈમેલ કરો અથવા 022-23058542/43

ગૌતમ જેમ્સ લિમિટેડ વતી સહી/- **ગૌતમ પી. શેઠ** મેનેજિંગ ડિરેક્ટર - DIN: 06748854 તારીખ: 06/09/2022 સ્થળ : સુરત

કાશોદર ખાતે આવેલ ઉજવણી કરવામાં આવી હતી.આ કરવામાં આવ્યું હતું.રજતજયંતિ પ્રસંગે મંડળના દાઉદી વ્હોરા ટ્રસ્ટના પ્રસંગે માધ્યમિક તેમજ ઉચ્ચતર

ચેરમેન શબ્બીરભાઇ હીરા, મંત્રી માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે અદનાનભાઇ દાદલા, સહિતના અત્યાધુનિક કમ્પ્યુટર લેબ સભ્યોએ હાઇસ્કૂલની મુલાકાત મહેમાનના હસ્તે ખુલ્લી મુકવામાં લીધી હતી. જેઓનું મંડળના પ્રમુખ આવી હતી



રજીસ્ટર્ડ ઓફિસ: 212, ન્યુ કલોથ માર્કેટ, રાયપુર દરવાજા બહાર, રાયપુર, અમદાવાદ - 380002. Phone No.: 91-79-2 2132078 E-mail: omkaroverseas212@gmail.com Website: www.omkaroverseasltd.com CIN: L51909GJ1994PLC023680

રકમી વાર્ષિક સામાન્ય સભાની નોટિસ ઈ-વોટીંગ અને બુક કલોઝર ની માહિતી

નોટિસ આપવામાં આવે છે કે

૧) કંપનીની રકમી વાર્ધિક સામાન્ય સભા (એજીએમ) શુક્રવાર, ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ બપોરે ૧૨.૦૦ વાગે કંપનીની રજસ્ટર્ડ ઓફિસ ૨૧૨, ન્યુ કલોથ માર્કેટ, રાયપુર દરવાજા બહાર, અમદાવાદ -૩૮૦૦૦૨ ખાતે ૧૨મી ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ મળેલ મીટિંગની નોટિસ માં જણાવ્યા મુજબના વ્યવસાયો માટે મળશે.

ર) એજીએમ ની નોટિસ અને નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટેના વાર્ષિક અહેવાલની ઈલેક્ટ્રોનિકની નકલો ૦૨, સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ શેર ધરાવતા તમામ સભ્યોને જેમના ઈમેલ આઈડીઓ કંપની / ડીપોઝટરી પાર્ટીસીપુન્ટ(ઓ) માં નોંધાયેલ છે તેઓને મોકલવામાં આવેલ છે. આ દસ્તાવેજો કંપનીની વેબસાઈટ www.omkaroverseasitd.com અને તેમજ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ ની વેબસાઈટ (CDSL www.evotingindia.com અને બોમ્બે સ્ટોક એકસચેન્જ (BSE) ની વેબૂસાઈટ www.bseindia.com ઉપર પણ ઉપલબ્ધ છે. એજીએમ ની નોટિસ અને વાર્ષિક અહેવાલ અન્ય તમામ સભ્યોને તેમના રજિસ્ટ્રડ સરનામે પરવાનગી મોડ માં મોકલવામાં આવ્યા છે. એજીએમ ની નોટિસ મોકલવાની પ્રક્રિયા ૦૮, સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ પૂર્ણ કરેલ છે. ૩) જે સભ્યો કટ ઓફ ડેટ (૨૩ સપ્ટેમ્બર ૨૦૨૨)ના રોજ ફિઝિકલ સ્વરૂપે

અથવા ડિમટીરિલાઈઝ્ડ સ્વરૂપે શેર ધરાવતા હશે તેઓ ઈલેકટ્રોનિક વોટિંગ પ્રણાલી દારા એજીએમ ની નોટિસમાં જણાવેલ કામકાજ મુજબ, વાટિંગ પ્રેક્ષાલા કારો અહેબને ના નાટિસના જણાવેલ કાનકાર મુજબ એજીએમ (રીમોર્ટ ઈ-વોટિંગ) સિવાયના અન્ય સ્થળે થી સેન્ટ્રલ ડિપોઝટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (CDSL) ની સિસ્ટમ મુજબ ઈલેક્ટ્રોનિક વોટિંગ કરી શકે છે. આ બધા સભ્યોને જણાવાયું છે કે : એજીએમ ની નોટિસમાં દર્શાવ્યા મુજબનો વ્યવસાય ઈલેકટ્રોનિક વોટિંગ માધ્યમ દ્વારા વ્યવહાર કરી શૅકાય છે.

🛮 રીમોટ ઈ-વોટિંગનો પ્રારંભ : મંગળવાર ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૨ (સવારે ૯.૦૦ વાગે.) iii. રીમોટ ઈ-વોટિંગનું સમાપન : ગુરૂવાર ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૨ (સાંજે ૫.૦૦ વાગે.)

IV. રીમોટ ઈ-વોટિંગ અથવા એજીએમ પર વોટિંગ કરવાની યોગ્યતા નક્કી કરવા માટેની કટ ઓફ તારીખ (૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૨) ∨ રીમોટ ઈ-વોટિંગ ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૨ ના સાંજે પ.૦૦ વાગ્યા

પછી માન્ય રહેશે નહી. ∨ા. એજીએમ ની નોટિસ મોકલયા બાદ કોઈ પણ વ્યકિત્એ શેર હસ્તગત કર્યા હોય અને કંપનીના સભ્યો બન્યા હોય તેમજ કટ ઓફ ડેટ (૦૨ સપ્ટેમ્બર, ૨૦૨૨) સુધી શેર જાળવી રાખ્યા હોય તો તેઓ પોતાનો login ID અને પાસવર્ડ helpdesk.evoting@cdslindia.com/ ahmedabad@linkintime.co.in પર વિનેતી કરી મેળવી શકશે.

VII. સભ્યો નોંધ લે : (a) રીમોટ ઈ-વોટિંગ મોડયુલ સેન્ટ્રલ ડિપોઝટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (CDSL) દ્વારા ર૯મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યા પછી અક્ષમ કરવામાં આવશે અને એક વાર સભ્યુએ ઠરાવ પર વોટ આપ્યા પછી સભ્યને તેને પછી થી બદલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. (b) બેલેટ / પોલ દ્રારા મતદાન કરવાની સુર્વિધા એજીએમ માં ઉપલબ્ધ કરાવવામાં આવશે. (c) જે સભ્યોએ એજીએમ પહેલા રીમોટ ઈ-વોટિંગ દ્રારા પોતાનો મત આપ્યો છે તે પણ એજીએમ માં હાજર રહી શકશે પરંતુ તેઓ કરીથી વોટિંગ કરવાને હેકકદાર રહેશે નહી અને (d) ફકત તે જ વ્યક્તિઓના નામ કે જેઓ સભ્યોના રજિસ્ટરમાં અથવા કટ ઓફ ડેટ મુજબ ડિપોઝીટરીઝ દ્વારા જાળવવામાં આવેલા બેનીફીસીયલ ઓનર્સના રજિસ્ટરમાં નોંધાયેલા છે ફકત તે જ રીમોટ ઈ-વોટિંગની સુવિધ માટે અથવા એજીએમ પર બેલેટ /

મતદાન થી વોટિંગ કરવા હકદાર રહશે. VIII.એજીએમની નોટિસ કંપુનીની વેબસાઈટ www.omkaroverseasitd.com અને સેન્ટ્રલ ડિપોઝટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (CDSL) વેબસાઈટ

www.evotingindia.com ઉપર પણ ઉપલબ્ધ છે. IX. ઈ-વોટિંગ સૂચનાઓ માટે, સભ્યો એજીએમ ની નોટિસમાં આપેલી સૂચનાઓમાંથી પસાર થઈ શકે છે અને ઈ-વોટિંગ સંબંધિત પ્રશ્નો / ફરિયાદોની બાબતમાં સભ્યો વારવાર પુછાતા પ્રશ્નો (FAQs) અને ઈ-વોટિંગ વપરાશકર્તા માર્ગદર્શન www.evotingindia.com પર થી હેલ્પ સેકશન હેઠળથી મેળવી શકે છે અથવા helpdesk.evoting@cdslindia.com ઉપર ઈમેલ કરો અથવા 1800 22 55 33 પર કોલ કરો અથવા શ્રીમતી જિનલ શાહ, કંપની સેક્રેટરી અને પાલન અધિકારીનો 212, ન્યુ કલોથ માર્કેટ, રાયપુર દરવાજા બહાર, રાયપુર, અમદાવાદ- 380002. E-mail id: omkaroverseas212@gmail.com, Phone No. 91-

79-22132078 નો સંપર્ક કરે. ૪) નોટિસમાં વધુમાં જણાવવાનું કે કંપનીઝ એકટ ૨૦૧૩ની કલમ ૯૧ની જોગવાઈઓને અનુસરીને કંપની (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) ૨૦૧૪ના નિયમ ૧૦ સાથે વાંચતા, AGM માં ભાગ લેવા માટે લાયક શેરધારકોની ખાતરી કરવા માટે કંપનીના સભ્યોના રજિસ્ટર પ્રેમી સપ્ટેમ્બર ૨૦૨૨ થી ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી (બન્ને દિવસો સહિત) બંધ રહેશે.

ઓમકાર ઓવરસીઝ લિમિટેડ વતી રમેશ દેઓરા

સ્થળ : અમદાવાદ ચેરમેન અને ડાયરેટર - DIN : 001135440 તારીખ: 08/09/2022









